

Seat No. : \_\_\_\_\_

## XS-112

April-2013

B.A. (Sem. II)

Geography : EC-I-111

(Physical Climatology and Oceanography)

Time : 3 Hours]

[Max. Marks : 70

1. (અ) સ્થાનિક પવનો વિશે માહિતી આપો. ૭

અથવા

વાતાવરણનું બંધારણ સમજાવો.

(બ) વરસાદના પ્રકાર અને વિતરણ સમજાવો. ૭

અથવા

વાદળોના પ્રકારો સમજાવો.

2. (અ) સમુક્રષ્ણના તાપમાન વિશે માહિતી આપો. ૭

અથવા

સમુક્રષ્ણની ક્ષારતા અંગે નોંધ લખો.

(બ) સમુક્રમોજાના પ્રકારોની માહિતી આપો. ૭

અથવા

મહાસાગરોના પ્રવાહની માનવજીવન પર થતી અસરો જણાવો.

3. ટૂંકનોંધ લખો : (કોઈપણ ચાર) ૧૬

- (૧) સૂર્યઘાતનું વિતરણ
- (૨) સમભાર રેખાઓ
- (૩) કાયમી પવનો
- (૪) વાતાવરણીય આદ્રતાનું મહત્વ
- (૫) ગુરુતમ અને લઘુતમ ભરતી
- (૬) સમુક્રતળનું ભૂપૃષ્ઠ

૪. એક-બે વાક્યમાં જવાબ લખો : ૧૨
- સમતાપસીમા એટલે શું ?
  - આબોહવાની વ્યાખ્યા આપો.
  - નિરપેક્ષ આક્રતા એટલે શું ?
  - જમીનની લહેર એટલે શું ?
  - મોસમી પવનો એટલે શું ?
  - દૈનિક ભરતી એટલે શું ?
૫. (અ) કૌંસમાંથી યોગ્ય વિકલ્ય પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ૭
- એક સરખી તાપમાન દર્શાવતી રેખાઓને \_\_\_\_\_ રેખા કહે છે.
    - સમોચ્ચતાપમાન
    - સમતાપ
    - સમભાર
  - ક્યા મહાસાગરમાં સૌથી લાંબી પર્વતમાળાઓ આવેલી છે.
    - પેસેફિક
    - એટલાન્ટિક
    - આર્કટિક
  - વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ \_\_\_\_\_ જેવા મળે છે.
    - ૦૦.૩૦
    - ૩૦.૦૦
    - ૦૦.૦૩
  - વિષુવવૃત્તીય પ્રદેશોમાં \_\_\_\_\_ વરસાદ પડે છે.
    - વંટોળનો
    - ભૂપૃષ્ઠનો
    - ઉષ્ણતાનયનનો
  - દરરોજ જેવા મળતા દરિયાના મોજા કેવા પ્રકારના મોજા કહેવાય છે ?
    - સામાન્ય
    - પ્રલયકારી
    - ત્સુનામી
  - સૂર્યની સપાટીનું તાપમાન સરેરાશ \_\_\_\_\_ °સે. છે.
    - ૨૦૦૦
    - ૫૦૦૦
    - ૭૦૦૦
  - \_\_\_\_\_ ના ભૂપૃષ્ઠ દર્શાવવા માટે હિસ્સોગ્રાફીક વક્ક દોરવામાં આવે છે.
    - મૃદાવરણ
    - વાતાવરણ
    - જલાવરણ
  - (બ) ‘ખરાં’ કે ‘ખોટાં’ ની નિશાની કરો. ૭
  - ટૂંકાગાળાની વાતાવરણની સરેરાશ સ્થિતિ ને હવામાન કહેવાય. \_\_\_\_\_
  - ભૂમધ્ય સમુદ્ર વિશ્વનો સૌથી વધુ ક્ષારતા ધરાવતો સમુદ્ર છે. \_\_\_\_\_.
  - સમતાપ આવરણ પૃથ્વી સપાટીની સૌથી નજીક છે. \_\_\_\_\_.
  - સૌથી વધુ સૂર્યાઘાત વિષુવવૃત્તીય પ્રદેશોને મળે છે. \_\_\_\_\_.
  - સમુદ્રની સૌથી વધુ ઉંચાઈ ૮ km છે. \_\_\_\_\_.
  - વ્યાપારી પવન એ કાયમી પવનનો પ્રકાર છે. \_\_\_\_\_.
  - સમુદ્રજળમાં ૧૦૦૦ ગ્રામ વજનમાં ૩૫ ગ્રામ ક્ષાર હોય છે. \_\_\_\_\_.

## XS-112

April-2013

B.A. (Sem. II)

Geography : EC-1-111

(Physical Climatology and Oceanography)

Time : 3 Hours]

[Max. Marks : 70

1. (a) Give information about local winds.

7

**OR**

Explain the composition of atmosphere.

- (b) Explain the types and distribution of rainfall.

7

**OR**

Explain types of clouds.

2. (a) Give information about temperature of Oceanic water.

7

**OR**

Write a note on salinity of oceanic water.

- (b) Give information on types of oceanic waves.

7

**OR**

Give information about effects of ocean currents on human life.

3. Write short notes (any **four**) :

16

- (1) Distribution of Insolation
- (2) Isobars
- (3) Planetary wind
- (4) Importance of atmospheric humidity
- (5) Spring and neap tides
- (6) Ocean relief

4. Answer in **one** or **two** sentences :

12

- (1) What is strapopause ?
- (2) Give definition of climate.
- (3) What is absolute humidity ?
- (4) What is land breezes ?
- (5) What is monsoon winds ?
- (6) What is diurnal tides ?

5. (A) Choose the right options for the following :

7

- (1) The line showing equal temperature is known as \_\_\_\_\_.  
(a) contour                   (b) isotherms                   (c) isobars
- (2) Which ocean has the longest mid oceanic ridge ?  
(a) Pacific                   (b) Atlantic                   (c) Arctic
- (3) Percentage of carbon dioxide in the atmosphere is \_\_\_\_\_.  
(a) 00.30                   (b) 30.00                   (c) 00.03
- (4) \_\_\_\_\_ type of rain falls in equatorial region.  
(a) Cyclonic                   (b) Orographic                   (c) Conventional
- (5) The sea waves seen normally are known as \_\_\_\_\_.  
(a) Surf                           (b) Surges                           (c) Tsunamis
- (6) The temperature of the surface of the Sun is \_\_\_\_\_ °C.  
(a) 2000                           (b) 5000                           (c) 7000
- (7) Hypsographic curve is drawn to show \_\_\_\_\_ relief features.  
(a) Lithosphere                   (b) Atmosphere                   (c) Hydrosphere

(B) State 'True' or 'False' :

7

- (1) An average condition of atmosphere for a short term is known as climate.  
\_\_\_\_\_.
  - (2) The Mediterranean Sea has the highest salinity. \_\_\_\_\_.
  - (3) Stratosphere is the closest to the earth's surface. \_\_\_\_\_.
  - (4) The Highest insolation is experienced near the equator. \_\_\_\_\_.
  - (5) The maximum depth of the sea is 8 k.m. \_\_\_\_\_.
  - (6) Trade winds are a type of planetary wind. \_\_\_\_\_.
  - (7) 1000 grams of sea water contains 35 grams of saline. \_\_\_\_\_.
- \_\_\_\_\_